

SARDAR PATEL UNIVERSITY
B. COM. SEMESTER - 1
ADVANCED ACCOUNTING - 1
UB01DCOM21

26 - OCTOBER - 2018 [FRIDAY]

TIME: 10.00 A.M. TO 12.00 P.M.

TOTAL MARKS: 60

પ્રશ્ન-૧: કુશ મેન્યુફેક્ચર્સ લિ. એ તા. ૧-૪-૨૦૧૫ના રોજ અન્ય લિ. પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦ની રોકડ કિંમત ધરાવતી મશીનરી ભાડા ખરીદ પદ્ધતિથી નીચેની શરતોએ ખરીદી. (૧૫)

શરતો : (૧) રૂ. ૪૦,૦૦૦ તા. ૧-૪-૨૦૧૫ના રોજ ચૂકવી આપવા.

(૨) રૂ. ૨૦,૦૦૦ તા. ૩૧-૩-૨૦૧૬ના રોજ ચૂકવી આપવા.

(૩) રૂ. ૨૦,૧૫૦ તા. ૩૧-૩-૨૦૧૭ના રોજ ચૂકવી આપવા.

(૪) રૂ. ૨૬,૨૫૦ તા. ૩૧-૩-૨૦૧૮ના રોજ ચૂકવી આપવા.

તમારે મશીનરી ખાતું, વ્યાજ ખાતું, અન્ય લિ. નું ખાતું તૈયાર કરવાના છે. વાર્ષિક બાકી પર ૫% લેખે વ્યાજ ગણવાનું છે. દરેક વર્ષે રોકડ કિંમત પર ૨૦% ધસારો ગણવાનો છે.

અથવા

પ્રશ્ન-૧:

(અ) હપતા પદ્ધતિ અને ભાડા ખરીદ પદ્ધતિ વચ્ચેનો તફાવત સમજાવો. (૦૫)

(બ) તા. ૧-૧-૨૦૧૫ના રોજ અર્થિતે રૂ. ૮૦,૦૦૦ની રોકડ કિંમતનું મશીન ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદ્યું. કરાર કરતી વખતે રૂ. ૩૦,૦૦૦ અને બાકીના રૂ. ૨૦,૦૦૦નો એક એવા ત્રણ વાર્ષિક હપતારોમાં રકમ ચૂકવાય છે. વ્યાજનો દર અને ધસારાનો દર ૧૦% છે. ધસારો ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ ગણવામાં આવે છે. અર્થિલના ચોપડે જરૂરી ખાતા (ચંત્ર અને વ્યાજ ખાતું) તૈયાર કરો. (૧૦)

પ્રશ્ન-૨: એશાએ દરેક રૂ. ૪,૦૦૦ની મૂળ કિંમતવાળા ૬૦ ટીવીસેટ મૂળ કિંમત પર ૨૫% નફો ચઢાવીને ભરતિયા કિંમતે ધરતીને આડતથી વેચવા મોકલ્યા. એશાએ માલ મોકલતી વખતે નીચે મુજબના ખર્ચા ચૂકવ્યા. નૂર રૂ. ૧,૨૦૦, મંજૂરી રૂ. ૩૦૦, વીમા પ્રીમિયમ રૂ. ૧,૫૦૦, પરચૂરણ ખર્ચા રૂ. ૩૦૦. (૧૫)

ધરતીને કુલ વેચાણ પર ૬% આડત અને ઉધાર વેચાણ પર ૨% આસામી આડત આપવામાં આવે છે.

રસ્તામાં ૪ ટીવીસેટને સંપૂર્ણ નુકસાન થયું. વીમા કંપનીએ રૂ. ૧૫,૦૦૦નો દાવો મંજૂર રાખ્યો.

ધરતીએ ૨૨ ટીવીસેટ દરેક રૂ. ૫,૫૦૦ના ભાવે રોકડેથી, ૧૮ ટીવીસેટ દરેક રૂ. ૫,૮૦૦ના ભાવે ઉધાર અને એક ટીવીસેટ એશાની ભલામણથી ભરતિયા કિંમતે મીતને ઉધાર વેચ્યું.

ધરતીએ નીચે મુજબના ખર્ચા ચૂકવ્યા.

જકાત રૂ. ૧,૧૨૦, વેચાણ ખર્ચા રૂ. ૨,૩૮૦.

મીત નાદાર બહાર થયો તેની પાસેથી રૂ. ૭૫ પૈસા લેખે રકમ વસૂલ થઈ. માલધણીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો.

અથવા

(૧)

(૧૫)